

L.L.B. Semester - 3 (CBCS) Examination**Oct/Nov. - 2018****PRINCIPLES OF TAXATION LAW (CORE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ કુલ આવકની ગણતરીમાંથી પ્રાપ્ત થતી કપાતો જણાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ મકાન મિલકતની આવક ગણતરી વખતે કઈ કઈ રકમો મજરે મળે છે – ચર્ચા કરો.
- પ્રશ્ન-૨ ધંધા વ્યવસાયની આવક સમજાવી મજરે ન મળતા ખર્ચાઓ ઉદાહરણ સાથે સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો સમજાવો.
- પ્રશ્ન-૩ માલ અને સેવા કર અધિનિયમ નીચે વેરો લેવા અને વસૂલ કરવા અંગે સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ માલ અને સેવા કર અધિનિયમ નીચે આકારની વિગતવાર સમજાવો.
- પ્રશ્ન-૪ માલ અને સેવા કર અધિનિયમ નીચે વેરાની ચૂકવની સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ માલ અને સેવા કર અધિનિયમ નીચે નોંધણી વિગતવાર સમજાવો.
- પ્રશ્ન-૫ ટુંકનોંધ લખો (કોઈપણ બે) (૧૪)
(1) આવકવેરા કાયદા નીચે મૂળમાંથી કપાત.
અથવા
(1) આવકવેરા કાયદા નીચે આકારણી.
(2) માલ અને સેવા કર અધિનિયમ નીચે વેરા ભરતિયું
અથવા
(2) માલ અને સેવા કર અધિનિયમ નીચે જમાનોંધ – ઉધાર નોંધ.

English Version

- Q-1 Explain the deductions available from the computation of total income. (14)
OR
- Q-1 Discuss in the enumerate deductions allowable while calculating income from house property.
- Q-2 Give examples of expences with discuss are disallowed under the head of business income. (14)
OR
- Q-2 Explain long term capital gain and shot term capital gain.
- Q-3 “Cover the tax and Recover the tax”. Explain under goods and service tax (14)
OR
- Q-3 Explain “Assessment” in detail under goods and service tax.
- Q-4 Explain “payment of tax” under goods and service tax. (14)
OR
- Q-4 Explain “Registration” under goods and service tax.
- Q-5 Write short notes (Any Two): (14)
(1) Tax deduction at source(TDS) under income tax act.
OR
(1) “Assessment” under income tax act.
(2) “Tax invoice” under goods and service tax.
OR
(2) “Credit note” and “debit note” under goods and service tax.